

રાજકોટ મહાનગરપાલિકા

પ્રાણીસંગ્રહાલય શાખા

ઇ-ટેન્ડર નં.રા.મ.ન.પા./ઝૂ/૨૦૨૦-૨૧/૦૧



રાજકોટ ઝૂલોજીકલ પાર્ક ખાતે લીલાશાકભાજી તથા ફળ સપ્લાય કરવાના કામનો વાર્ષિક
રેઇટ કોન્ટ્રાક્ટ કરવાનું કામ

૧	ટેન્ડર ફી (પરત મળવાપાત્ર નથી)	રૂ.૧૧૨૫/-
૨	અર્નેસ્ટમની ડીપોઝીટ	રૂ.૨૧,૩૦૦/-
૩	ઇ-ટેન્ડર ડાઉનલોડની કરવાની છેલ્લી તારીખ	તા.૦૧/૦૬/૨૦૨૦ ૧૬:૦૦ કલાક સુધી
૪	ઇ-ટેન્ડર ઓનલાઇન સબમીટની છેલ્લી તારીખ	તા.૦૧/૦૬/૨૦૨ ૧૮:૦૦ કલાક સુધી
૫	ટેન્ડર (ટેન્ડર ફી, અર્નેસ્ટમની, પ્રાઈઝબીડ અલગ કવરમાં તથા અન્ય કાગળો) મોકલવાની વિગત	સીલબંધ કવરમાં ફક્ત પોસ્ટ મારફ્ટ તા.૦૨/૦૬/૨૦૨ થી તા.૦૬/૦૬/૨૦૨ સુધીમાં ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટશ્રી, રાજકોટ ઝૂલોજીકલ પાર્ક, માર્કેટીંગ યાર્ડની પાછળ, રાજકોટ-૩૬૦૦૦૩ ખાતે મોકલાવવાનું રહેશે.
૬	ઓનલાઇન ટેકનીકલ બીડ ખોલવાની તારીખ	તા.૧૦/૦૬/૨૦૨ ૧૧:૦૦ કલાકે
૭	વેરીફિકેશન ઓફ ટેકનીકલ બીડ	તા.૧૦/૦૬/૨૦૨ ૧૦:૩૦ કલાક સુધી
૮	ઓનલાઇન પ્રાઈઝબીડ ખોલવાની સંભવિત તારીખ	તા.૧૧/૦૬/૨૦૨ ૧૧:૦૦ કલાકે
	વધુ જાણકારી માટે અમારો સંપર્ક કરો. ડો.આર.કે.હિરપરા ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટ મો.૯૯૭૮૯ ૧૧૨૪૫	

ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટશ્રી,
રાજકોટ ઝૂલોજીકલ પાર્ક,
માર્કેટીંગ યાર્ડની પાછળ,
રાજકોટ.

અનુક્રમણિકા

ક્રમ	વિગત	પાના નં.
૧	ટેન્ડરની શરતો	૦૩-૦૬
૨	બીડરની વિગત	૦૭
૩	અનુભવની વિગત	૦૮
૪	પ્રાઈઝબીડ	૦૯

રાજકોટ ઝૂલોજીકલ પાર્ક ખાતે લીલાશાકભાજી તથા ફળ સપ્લાય કરવાના કામ અંગેની શરતો

સામાન્ય શરતો :-

- 1) બીડરે ટેન્ડર ફી પેટે રૂ.૧૧૨૫/- (અંકે રૂપિયા એક હજાર એકસો પચીસ)નો નેશનલાઇઝડ/શેડ્યુલ્ડ બેંકનો ડીમાન્ડ ડ્રાફ્ટ “રાજકોટ મહાનગરપાલિકા” (Rajkot Municipal Corporation) Payable at Rajkotના નામનો ટેન્ડર સાથે સામેલ રાખવાનો રહેશે.
- 2) બીડરે અર્નેસ્ટમની ડીપોઝીટ પેટે રૂ.૨૧,૩૦૦/- (અંકે રૂપિયા એકવીસ હજાર ત્રણસો)નો નેશનલાઇઝડ/શેડ્યુલ્ડ બેંકનો ડીમાન્ડ ડ્રાફ્ટ “રાજકોટ મહાનગરપાલિકા” (Rajkot Municipal Corporation) Payable at Rajkotના નામનો ટેન્ડર સાથે સામેલ રાખવાનો રહેશે.
- 3) ટેન્ડર ફી તથા અર્નેસ્ટમની ડીપોઝીટ ભર્યા વગરના ટેન્ડર ધ્યાન પર લેવામાં આવશે નહીં તથા ટેન્ડર રદ ગણવામાં આવશે.
- 4) જે બીડરનું ટેન્ડર મંજૂર થશે, તેમના અર્નેસ્ટમની ડીપોઝીટના નાણા અનામત પેટે જમાં રાખી બાકી બીડરના ટેન્ડર સાથે ભરેલ અર્નેસ્ટમની ડીપોઝીટની રકમ માંગણી કર્યા બાદ પરત કરવા કાર્યવાહી કરવામાં આવશે.
- 5) ભાવ મંજૂર કરવા મ્યુનિસિપલ કમિશનરશ્રી અથવા સ્ટેન્ડીંગ કમિટી, રાજકોટ મહાનગરપાલિકાને મોકલવામાં આવશે. તેમનો નિર્ણય આખરી અને બંધનકર્તા રહેશે.
- 6) ભાગીદારીમાં ટેન્ડર ભરનારે ભાગીદારીનું સટીફિકેટ રજૂ કરવાનું રહેશે. જો તેઓનું ટેન્ડર મંજૂર થાય તો ભાગીદારો અથવા કોઇ પણ એક ભાગીદારને કમિશનરશ્રી જવાબદાર ગણી શકશે. તેમજ ટેન્ડરની શરતોનો ભંગ થયે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાશે.
- 7) સગીરવયની વ્યક્તિનું ટેન્ડર સ્વીકારવામાં આવશે નહિં. શંકાસ્પદ કિસ્સામાં વ્યક્તિનું ઉંમરનું પ્રમાણપત્ર માંગવામાં આવશે. જે રજૂ કરવાનું રહેશે.
- 8) ભાવ મંજૂર થયે બીડરે કામગીરીની કુલ કીંમતના ૦૫% (પાંચ ટકા) મુજબ સિક્યોરીટી ડીપોઝીટ ભરવાની રહેશે. સિક્યોરીટી ડીપોઝીટની રકમ રોકડેથી કે ચેક કે ડી.ડી.થી ભર્યેના કિસ્સામાં રાજકોટ મહાનગરપાલિકાની હિસાબી શાખામાં રકમ ભર્યા બદલની અસલ પહોંચ રજૂ કરી રૂ.૧૦૦/-ના સ્ટેમ્પ પેપર પર કરારનામું કરી આપવાનું રહેશે.
- 9) બિડર દ્વારા એફ..ડી.આર.ના કિસ્સામાં રાજકોટ ખાતેની નેશનલાઇઝડ/શેડ્યુલ્ડ બેંકની રાજકોટ મહાનગરપાલિકા તથા બીડરના સંયુક્ત નામની એફ..ડી.આર. કઢાવી પાછળ રેવન્યુ સ્ટેમ્પ લગાડી તેના પર કોન્ટ્રાક્ટરશ્રીએ સહી કરી રાજકોટ ઝૂલોજીકલ પાર્કમાં નિયત સમયમાં રજૂ કરવાની રહેશે. ફિક્સ ડીપોઝીટ રીસીપ્ટના માધ્યમથી ભરવાના કિસ્સામાં સિક્યોરીટી ડીપોઝીટના ૪.૮૦% પ્રમાણેના સ્ટેમ્પ પેપર પર કરારનામું કરવાનું રહેશે. સ્ટેમ્પ અને નોંધણી વિભાગ દ્વારા સ્ટેમ્પ ડ્યુટીમાં ફેરફાર થશે તો તે આપો આપ બિડરને લાગુ પડશે.
- 10) બિડરે રાજકોટ મહાનગરપાલિકાની ફેવરમાં સિક્યોરીટી ડીપોઝીટની રકમ ભરી કરારનામું દિન-૦૭માં કરી આપવાનું રહેશે. કરારનામાનો મુસદ્દો રાજકોટ ઝૂલોજીકલ પાર્કમાંથી મેળવી લેવાનો રહેશે.
- 11) બિડર નિયત સમયમાં કરારનામું કરવામાં નિષ્ફળ જશે તો બિડરની અર્નેસ્ટમનીની રકમ જપ્ત કરવામાં આવશે. તેમજ રાજકોટ મહાનગરપાલિકા આ કોન્ટ્રાક્ટ કોઇ પણ અન્ય કોન્ટ્રાક્ટરને આપી શકશે.

- 12) સરકારશ્રી તરફથી નિયત કરવામાં આવેલ ઇન્કમેટેક્સ તેમજ અન્ય ટેક્સની રકમ નિયમાનુસાર બીડરનાં બીલમાંથી કાપી લેવામાં આવશે.
- 13) બિડરે ટેન્ડરની વિગત ભરી ટેન્ડર સાથે સામેલ રાખવાની રહેશે.
- 14) મ્યુનિસિપલ કમિશ્નરશ્રી કોઇ પણ જાતનું કારણ દર્શાવ્યા સીવાય ટેન્ડર રદ કરી શકશે.
- 15) આ કરાર અંગે કોઇ વાદવિવાદ ઉપસ્થિત થશે તો, તે ફક્ત રાજકોટ જ્યુરીશડીકશનમાં ચાલી શકશે.
- 16) પ્રાઇઝબીડ ખોલ્યા બાદ ટેન્ડર ૧૨૦ દિવસ સુધી માન્ય રહેશે.
- 17) દર માસના અંતે બીલ રજુ કર્યા બાદ ચુકવણું કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. બીલની રકમ સીધી કોન્ટ્રાક્ટરશ્રીના ખાતામાં ECSથી જમા કરવામાં આવશે. બીડરે બેંક એકાઉન્ટની વિગત, પાનકાર્ડની વિગત તથા જીએસટીની વિગત (જો લાગુ પડતુ હોય તો) રજુ કરી વેન્ડર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
- 18) ઇજારાની કોઇ પણ એક શરતના ભંગ બદલ રૂ.૫૦૦/- (અંકે રૂપિયા પાંચસોથી વધારે નહી તેટલો) દંડ જવાબદાર અધિકારી (નાયબ કમિશ્નરશ્રી) કરી શકશે. તે પ્રમાણેની રકમ બિડરે રાજકોટ મહાનગરપાલિકામાં ભરપાઇ કરવાની રહેશે.
- 19) ટેન્ડર સંબંધી કોઇ વાંધો હોય તો, બીડરે મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, રાજકોટ મહાનગરપાલિકાને લેખિતમાં અરજી કરવાની રહેશે. આ બાબતે કમિશ્નરશ્રીનો નિર્ણય આખરી અને બીડરને બંધનકર્તા રહેશે.
- 20) બિડરનું કામ કોન્ટ્રાક્ટના સમયગાળા દરમિયાન સંતોષકારક જણાશે તો કોન્ટ્રાક્ટની મુદત પુરી થયે બિડર દ્વારા સીક્યોરીટી ડીપોઝીટ પરત કરવા માટેની માંગણી રજુ કર્યા બાદ સીક્યોરીટી ડીપોઝીટ પરત આપવાની કાર્યવાહી કરવામાં આવશે.
- 21) આ કામ સંબંધે કોઇ શરતોમાં સમાવેશ થતો ન હોય અથવા સમયાનુસાર કે ચાલુ કામે કોઇ આવી શરતો બાબતે પ્રશ્ન ઉપસ્થિત થાય તો કમિશ્નરશ્રી, રા.મ.ન.પા.નો નિર્ણય અંતિમ રહેશે. જે કોન્ટ્રાક્ટરશ્રીને બંધનકર્તા રહેશે. સંજોગોવશાત જરૂરિયાત ઉપસ્થિત થાય તો કમિશ્નરશ્રી, રા.મ.ન.પા. આ કોન્ટ્રાક્ટ રદ કરી શકશે.
- 22) ટેકનીકલ બીડમાં જરૂરી દસ્તાવેજો પુરાવાઓ, ટેન્ડર ફી અને અર્નેસ્ટમની ડીપોઝીટની ફી રજુ કરેલ હશે એ જ પાર્ટીઓની પ્રાઇઝ બીડ ખોલવામાં આવશે.
- 23) ટેકનીકલ બીડ સીલબંધ કવરમાં ફક્ત પોસ્ટ કે રજી. એ.ડી.થી ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટશ્રી, રાજકોટ ઝૂલોજીકલ પાર્ક, માર્કેટીંગ ચાર્ડની પાછળ, રાજકોટ.-૩૬૦૦૦૩ને નિયત સમય મર્યાદામાં પહોંચતુ કરવાનું રહેશે. કવર ઉપર "લીલાશાકભાજી તથા ફળ સપ્લાય કરવાના ભાવ" એ પ્રમાણે સ્પષ્ટ લખવાનું રહેશે. નિયત સમય મર્યાદા બાદ મળેલ ટેકનીકલ બીડ માન્ય રહેશે નહીં.
- 24) બીડરે બીડરની વિગત દર્શાવતા પત્રકમાં તમામ વિગત દર્શાવવાની રહેશે.
- 25) ટેન્ડર ભરનારે ટેકનીકલ બીડમાં રજુ કરેલ તમામ દસ્તાવેજો ફરજિયાતપણે ખરી નકલમાં અથવા સેલ્ફ એટેસ્ટેડ કરી મોકલવાની રહેશે.
- 26) બીડરે ટેન્ડર સાથે રજુ કરેલ સંબંધીત તમામ દસ્તાવેજોની મૂળ નકલની ખરાઇ કર્યા બાદ જ તેઓના ટેન્ડરની પ્રાઇઝબીડ ખોલવામાં આવશે. બીડરે રજુ કરેલ કોઇ પણ દસ્તાવેજો ફોડ રજુ કરી કામ મેળવવા

માટે પ્રયાસ કર્યાનુ સાબિત થશે, તેવા કિસ્સામાં એજન્સીને બ્લેકલીસ્ટ કરી, બીડર સામે ફોજદારી કાર્યવાહી કરવાના પગલા લેવામાં આવશે.

ખાસ શરતો :-

- 1) ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટ અથવા અન્ય જવાબદાર અધિકારી જરૂરીયાત પ્રમાણે લીલાશાકભાજી-ફળના જથ્થામાં વધારો કે ઘટાડો કરી શકશે. હાલ પ્રાણીસંગ્રહાલયની લીલાશાકભાજી-૧૭.૦ કિગ્રા. તથા ફળ-૧૫.૫ કિગ્રા. દૈનિક જરૂરીયાત છે. ઝૂ કચેરીની સુચના મુજબ લીલાશાકભાજી તથા ફળ પુરા પાડવાના રહેશે.
- 2) પ્રાણી-પક્ષીઓની સંખ્યામાં વધ/ઘટ મુજબ તથા લીલાશાકભાજી તથા ફળની જરૂરીયાત મુજબ જથ્થામાં ફેરફાર કરવામાં આવશે. ઉક્ત કરવામાં આવતા ફેરફાર મુજબ લીલાશાકભાજી તથા ફળ સપ્લાય કરવાના રહેશે.
- 3) લીલાશાકભાજી તથા ફળ રાજકોટ ઝૂલોજીકલ પાર્ક, માર્કેટીંગ યાર્ડની પાછળ, રાજકોટ ખાતે સપ્લાય કરવાના રહેશે. તે માટે ટ્રાન્સપોર્ટ ચાર્જ, ઉતરાઈ કે અન્ય કોઈ મજૂરી આપવામાં આવશે નહીં.
- 4) બિડરે લીલાશાકભાજી તથા ફળનો જથ્થો સવારના ૦૮:૦૦ વાગ્યા સુધીમાં ફરજિયાત પહોંચતતો કરવાનો રહેશે. લીલાશાકભાજી તથા ફળ સપ્લાય કરવામાં નિષ્ફળ જશે / લીલાશાકભાજી તથા ફળનો જથ્થો જરૂરીયાત કરતા ઓછો આવશે ત્યારે ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટ અથવા અન્ય જવાબદાર અધિકારી દ્વારા તેના ખર્ચે અને જોખમે બજારમાંથી લીલાશાકભાજી તથા ફળ ખરીદ કરવામાં આવશે. તે માટે કરેલ ખર્ચ તેના બીલ કે ડીપોઝીટમાંથી કાપી લેવામાં આવશે. પરંતુ ફાયદો થયે ઇજારાદાર તેમાં હક્કદાર રહેશે નહીં.
- 5) બિડરે સપ્લાય કરેલ લીલાશાકભાજી તથા ફળ હલકી ગુણવત્તાવાળા કે ફળ વધુ પાકેલા કે વધુ કાચા ન હોય તેવા સપ્લાય કરવાના રહેશે. ફળ વાસી કે સુકાઈ ગયેલા કે ખરાબ ન હોવા જોઈએ.
- 6) ઝૂ ખાતે ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટ અથવા અન્ય જવાબદાર અધિકારી દ્વારા લીલાશાકભાજી તથા ફળનો વજન કરવામાં આવશે. જે ઇજારાદારે અથવા લીલાશાકભાજી તથા ફળ સાથે આવેલ તેના એજન્ટે માન્ય રાખવો પડશે. લીલાશાકભાજી તથા ફળમાં કોઈ પણ જાતની ખરાબી અથવા વાસી તેમજ ખરાબ જણાશે તો તે સ્વીકારવામાં આવશે નહીં. ખરાબ લીલાશાકભાજી તથા ફળ તુરંત બદલી આપવાના રહેશે.
- 7) બિડરે લીલાશાકભાજી તથા ફળ સપ્લાયની શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. કોઈ પણ કારણોસર બીડર લીલાશાકભાજી તથા ફળ સપ્લાય કરવામાં નિષ્ફળ જશે તો બીડરે ભરેલ સીકયોરીટી ડીપોઝીટની રકમ જપ્ત કરી કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવશે અને કોન્ટ્રાક્ટરને રાજકોટ મહાનગરપાલિકાના આ કામ માટે બ્લેક લીસ્ટ કરવામાં આવશે.
- 8) સપ્લાય ઓર્ડર મળ્યાથી ઓર્ડરમાં દર્શાવેલ તારીખથી લીલાશાકભાજી તથા ફળ સપ્લાય કરવાનું ચાલુ કરવાનું રહેશે.
- 9) બિડર આ કોન્ટ્રાક્ટ અન્ય કોઈ કોન્ટ્રાક્ટર/બિડરને પેટામાં આપી શકશે નહીં. અને જો પેટામાં કોન્ટ્રાક્ટ આપી દીધેલ માલુમ પડશે તો જરૂર જણાયે કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવશે.
- 10) ભવિષ્યમાં લીલાશાકભાજી તથા ફળની જરૂરીયાત ન રહે તો રાજકોટ મહાનગરપાલિકા ગમે ત્યારે કોન્ટ્રાક્ટ બંધ કરી શકશે. જે બીડરને બંધનકર્તા રહેશે.

- 11) લીલાશાકભાજી તથા ફળ સપ્લાય કોન્ટ્રાક્ટનો સમયગાળો એક વર્ષનો રહેશે. એક વર્ષ પુરૂ થયા બાદ નવો કોન્ટ્રાક્ટ આપવામાં કોઈ પણ કારણસર મોડુ થશે તો કોન્ટ્રાક્ટ ત્રણ માસ સુધી લંબાવી શકાશે. લંબાવેલ મુદત માટે કોઈ ભાવ વધારો આપવામાં આવશે નહિં.
- 12) બીડરે લીલાશાકભાજી તથા ફળ સપ્લાયનાં પ્રતિ કિ.ગ્રા.નાં ભાવ અલગ અલગ ઓનલાઇન ભરવાનાં રહેશે.
- 13) બીડરના પ્રાઇઝબીડમાં દર્શાવેલ લીલાશાકભાજી તથા ફળ સપ્લાય માટે સૌથી ઓછા ભાવ ભરનાર કોઈ એક જ એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. જરૂરે જણાયે સૌથી ઓછા ભાવની ગણતરી દૈનિક ખર્ચનાં આધારે નક્કી કરવામાં આવશે અને તે જ ભાવ માન્ય રાખવામાં આવશે.

લાયકાતની વિગત :-

- 1) બીડરે ટેન્ડર ફી પેટે રૂ.૧,૧૨૫/- (અંકે રૂપિયા એક હજાર એકસો પચીસ) તથા અર્નેસ્ટમની ડીપોઝીટ પેટે રૂ.૨૧,૩૦૦/- (અંકે રૂપિયા એકવીસ હજાર ત્રણસો)નો નેશનલાઇઝડ/શેડ્યુલ્ડ બેંકનો ડીમાન્ડ ડ્રાફ્ટ “રાજકોટ મહાનગરપાલિકા” (Rajkot Municipal Corporation) Payable at Rajkotના નામનો ટેન્ડર સાથે સામેલ રાખવાનો રહેશે.
- 2) બિડરે આ પ્રકારની કામગીરી એટલે કે લીલાશાકભાજી તથા ફળ સપ્લાય કરવા અંગેનો કોઈ પણ સરકારી કે અર્ધસરકારી સંસ્થામાં છેલ્લા સાત નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા એક વર્ષ સુધી સંતોષકારક રીતે લીલાશાકભાજી તથા ફળ સપ્લાય કરેલ હોવાના અનુભવનું પ્રમાણપત્ર ટેન્ડર સાથે સામેલ રાખવાનું રહેશે.

નાયબ કમિશ્નર (પુર્વઝોન)
રાજકોટ મહાનગરપાલિકા

બીડરની વિગત

૧	૧	બીડરનું નામ	
	૨	સરનામું	
	૩	ટેલીફોન નંબર તથા મોબાઇલ નં.	
૨			
		રા.મ.ન.પા.એ કોન્ટ્રાક્ટ માટે જેની સાથે સંપર્ક કરવાનો થાય તેની માહિતી	
	૧	નામ	
	૨	સરનામું	
	૩	ટેલીફોન નંબર	
	૪	મોબાઇલ નં.	
	૫	ફેક્સ નંબર	
૩			
		કોન્ટ્રાક્ટમાં સહી કરનારની વિગત	
	૧	નામ	
	૨	સરનામું	
	૩	ટેલીફોન નંબર	
	૪	મોબાઇલ નં.	
	૫	ફેક્સ નંબર	



રાજકોટ મહાનગરપાલિકા પ્રાણીસંગ્રહાલય શાખા



-:: બીડરના અનુભવની વિગત ::-

અમો બીડરશ્રી, રહેવાસી
..... નીચે મુજબ લીલાશાકભાજી તથા ફળ સપ્લાય કામનો અનુભવ ધરાવીએ છીએ. જેની
વિગત નીચે મજુબ છે.

ક્રમ	લીલાશાકભાજી તથા ફળ સપ્લાય કરેલ સ્થળ તથા સરનામું	સમય	નોંધ
૧			
૨			
૩			
૪			
૫			

ઉપરોક્ત અનુભવના આધાર તરીકે ટેન્ડર સાથે અગાઉની કામગીરીના અનુભવના પ્રમાણપત્રની પ્રમાણીત નકલ આ સાથે સામેલ છે.



રાજકોટ મહાનગરપાલિકા
પ્રાણીસંગ્રહાલય શાખા



-:: પ્રાઇઝ બીડ ::-

(ફક્ત ઓનલાઇન ઇલેક્ટ્રોનિક ફોરમેટમાં ભરવાનું રહેશે.)

ક્રમ	વિગત	સપ્લાયની વિગત
૧	રાજકોટ ઝુલોજીલ પાર્ક ખાતે લીલાશાકભાજી તથા ફળ સપ્લાય કરવા માટે રેઇટ કોન્ટ્રાક્ટ કરવા બાબત	લીલાશાકભાજી સપ્લાયના પ્રતિ કિગ્રાના ભાવ રૂ.....(અંકે રૂપિયા પુરા)
		ફળ સપ્લાયના પ્રતિ કિગ્રાના રૂ.....(અંકે રૂપિયા પુરા)

નોંધ : બીડરે આ પત્રકમાં ભાવ ભરવાના નથી, લીલાશાકભાજી તથા ફળ સપ્લાયના ભાવ ઓનલાઇન જ ભરવાના છે.

નાયબ કમિશ્નર(પુર્વઝોન)
રાજકોટ મહાનગરપાલિકા